

SARDAR PATEL UNIVERSITY
B.Com. (General & Honours) (I Semester) (NC) Examination
Wednesday, 19th October 2016

2.00 pm - 4.00 pm

UB01ECOM01/17 : Corporate Accounting- I

Total Marks: 60

નોંધ : જમણીબાજુ દર્શાવેલ આંકડા ગુણ દર્શાવે છે.

પ્ર.૧

(અ) કિષ્ના લિ. એ જાહેરજનતા માટે ૧૦૦૦૦ ઈ.શેર, ૨૦% પ્રિમિયમથી, દરેક રૂ. ૧૦૦નો એક એવા (૧૨) બહાર પાડ્યા. શેરદીઠ રકમ નીચે મુજબ મંગાવી.

અરજી સાથે રૂ. ૨૦

મંજૂરી સાથે રૂ. ૪૦ (પ્રિમિયમ સહિત)

પ્રથમ હપ્તા સાથે રૂ. ૩૦

બીજા હપ્તા સાથે રૂ. ૩૦

૧૬૦૦૦ શેર માટે અરજીઓ મળી. વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને વધારાની અરજીના નાણાં પરત કરવામાં આવ્યા.

મીરા કે જેને ૫૦૦ શેર આપવામાં આવ્યા હતા તેમણે ફક્ત મંજૂરીની પુરી રકમ ચુકવી.

રાધા કે જેને ૪૦૦ શેર આપવામાં આવ્યા હતા તે મંજૂરીનાં નાણાં ભરવામાં નિષ્ફળ રહી.

રૂકમણી કે જેને ૩૦૦ શેર આપવામાં આવ્યા હતા તે પ્રથમ અને બીજો હપ્તો ભરી શકી નહીં.

મીરા, રાધા અને રૂકમણીના શેરો જપ્ત કરવામાં આવ્યા અને ફરીથી રૂ. ૮૦ના ભાવે પૂર્ણ ભરપાઈ તરીકે બહાર પાડવામાં આવ્યા.

કિષ્ના લિ.ના ચોપડે જરૂરી આમનોંધ લખો.

(બ) ટૂંકનોંધ લખો : શેરજમી

(૦૩)

અથવા

પ્ર.૧

(અ) ધી નિલકંઠ કન્સ્ટ્રક્શન કં. લિ. એ ૧૦૦૦૦ ઈ.શેરો, દરેક રૂ. ૧૦૦નો એક એવા ૧૦% વટાવે (૧૦) બહાર પાડ્યા. જે માટે ૩૦૦૦૦ અરજીઓ મળી. રકમ નીચે મુજબ ચૂકવવામાં આવી.

અરજી સાથે રૂ. ૨

મંજૂરી સાથે રૂ. ૩

પ્રથમ હપ્તા સાથે રૂ. ૨

બીજા હપ્તા સાથે રૂ. ૨

વધારાની અરજીઓ નામંજૂર કરી અને તેનાં નાણાં પરત કરવામાં આવ્યા.

કિર્તિને ૨૦૦ શેર આપવામાં આવ્યા હતા તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શક્યો નહીં. તેથી તેના શેર જપ્ત કરવામાં આવ્યા અને રૂ. ૭ના ભાવે ફરીથી પૂર્ણ ભરપાઈ તરીકે બહાર પાડવામાં આવ્યા.

કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો.

(બ) ટૂંકનોંધ લખો : મળવાના બાકી હપ્તા અને અગાઉથી મળેલ હપ્તા.

(૦૫)

પ્ર.૨

(અ) નીચેના ખાતાનું વાંચન અને વિવેચન કરો.

(૦૮)

ઉ ચંત્રનું ખાતું			જ		
તારીખ	વિગત	રૂ.	તારીખ	વિગત	રૂ.
૨૦૧૫			૨૦૧૫		
જૂન-૧	બા.આ.લા.	૫૦૦૦૦	જૂન-૨૫	બેંક ખાતે	૮૦૦૦
ફેબ્રુ.-૧૫	પટેલ એન્ડ સન્સ ખાતે	૨૦૦૦૦	જૂન-૨૫	નફા-નુકશાન ખાતે	૨૦૦૦
ફેબ્રુ.-૧૮	ટ્રક ભાડા ખાતે	૨૦૦૦	માર્ચ-૩૧	બા.આ.લ. ગયા	૬૫૦૦૦
માર્ચ-૨૫	મજુરી ખાતે	૩૦૦૦			
		૭૫૦૦૦			૭૫૦૦૦

(બ) પાકા-સરવૈયાની મર્યાદાઓ કઈ-કઈ છે? ચર્ચો.

(૦૭)

અથવા

પ્ર.૨

(અ) પાકા સરવૈયાના હેતુઓ વિશે ટૂંકનોંધ લખો.

(૦૭)

(બ) નીચેના ખાતાનું વાંચન અને વિવેચન કરો.

(૦૮)

ઉ નયનનું ખાતું			જ		
તારીખ	વિગત	રૂ.	તારીખ	વિગત	રૂ.
૨૦૧૬			૨૦૧૬		
માર્ચ-૧	બેંક ખાતે	૧૫૦૦૦	જાન્યુ.-૧	બા.આ.લા.	૪૦૦૦૦
ડિસે.-૩૧	ઉપાડ પર વ્યાજ ખાતે	૧૫૦૦	જુલાઈ-૧	બેંક ખાતે	૧૦૦૦૦
ડિસે. ૩૧	બા.આ.લ. ગયા	૫૩૫૦૦	ઓક્ટો.-૧	ફર્નિચર ખાતે	૫૦૦૦
			ડિસે.૩૧	મૂડી પરના વ્યાજ ખાતે	૪૬૨૫
			ડિસે.૩૧	નફા-નુકશાન ખાતે	૧૦૩૭૫
		૭૦૦૦૦			૭૦૦૦૦

પ્ર.૩ A કં. લિ.નું તા. ૩૧-૩-૨૦૧૬ના રોજનું કાચુ સરવૈયું નીચે મુજબ છે.

(૧૫)

ઉદાર બાકી	રૂ.	જમા બાકી	રૂ.
જમીન અને મકાન	૩૫૦૦૦૦	ઈક્વિટી શેરમૂડી દરેક	
પ્લાન્ટ અને ચંત્ર	૩૦૦૦૦૦	રૂ. ૧૦નો એક એવા.	૬૪૦૦૦૦
ડિબેન્ચર વટાવ	૪૪૮૦૦	૧૦% પ્રેફરન્સ શેર મૂડી દરેક	
ખરીદી	૫૦૮૦૦૦	રૂ. ૧૦૦ના એક એવા	૧૫૦૦૦૦
શરૂનો સ્ટોક	૮૦૦૦૦	વેચાણ	૧૨૦૦૦૦૦
ડિબેન્ચર પર વ્યાજ	૨૪૦૦૦	૧૦%ના ડિબેન્ચર	૨૪૦૦૦૦
માલ પરત	૬૧૦૦૦	ડિરેક્ટરોની લોન	૨૪૦૦૦
દેવાદારો	૨૪૦૦૦૦	માલ પરત	૩૨૦૦૦
વાહનો	૮૦૦૦	લેણદારો	૧૮૦૦૦૦
કસ્ટમ ડિપોઝીટ	૧૬૦૦૦	સ્ટાફ પેન્શન ફંડ	૧૬૪૦૦
અગાઉથી ચુકવેલ આવક વેરો	૩૬૦૦૦	લોન પર ચૂકવવાનું વ્યાજ	૧૦૦૦
વહીવટી ખર્ચ	૧૩૩૦૦૦	વ્યાજ અને ડિવિડન્ડ	૧૫૦૦૦
પગાર	૨૦૨૦૦૦	શેરજમી ખાતુ	૭૦૦૦
જકાત	૧૫૦૦૦૦	બાંધી મુદતની થાપણ	૩૦૦૦
વેચાણ અને વિતરણ ખર્ચ	૨૭૦૦૦	સામાન્ય અનામત	૮૧૬૦૦
ડિરેક્ટરોની ફી	૨૩૦૦	નફા-નુકશાન ખાતુ	૨૦૦૦૦
રોકાણો	૧૮૨૦૦૦	(૧-૪-૧૫)	

છૂટા ઓજારો	૬૦૦૦		
લેણી હૂંડી	૧૪૦૦૦૦		
બાંહેધરી કમિશન	૧૦૦૦૦		
બેંકમાં રોકડ	૫૮૦૦૦		
હાથ પર રોકડ	૩૦૮૦૦		
	૨૬૨૦૦૦૦		૨૬૨૦૦૦૦

વધારાની માહિતી :

- (૧) રૂા. ૧૦૦૦૦ સામાન્ય અનામત ખાતે લઈ જાવો.
- (૨) આખર સ્ટોક રૂા. ૧૫૦૦૦૦.
- (૩) પ્લાન્ટ અને ચંત્ર પર ૧૦%, જમીન અને મકાન પર ૧૨% અને વાહનો પર ૧૫% લેખે વાર્ષિક ઘસારો ગણો.
- (૪) બાંહેધરી કમિશન ૨૫% માંડીવાળો.
- (૫) દેવાદારો પર ૧૦% ઘાલખાધ અનામત ગણો.
- (૬) કિરેક્ટરોએ ઈક્વિટી શેરમૂડી પર ૧૫% લેખે કિવિડન્ડ ચુકવવાનું નક્કી કર્યું છે.

ઉપરોક્ત માહિતી પરથી આડા પાકા સરવૈયાના સ્વરૂપમાં કંપનીધારા-૧૯૫૬ પ્રમાણે પાકુ-સરવૈયું તૈયાર કરો.

અથવા

પ્ર.૩ કેવી કં. ના ચોપડામાં તા. ૩૧ માર્ચ ૨૦૧૫ના રોજ નીચેની બાકીઓ હતી.

(૧૫)

વિગતો	જમા રૂા.	વિગતો	ઉધાર રૂા.
૧૦૦૦૦ ઈક્વિટી શેર દરેક રૂા. ૧૦૦ના	૧૦૦૦૦૦૦	જમીન અને મકાન સ્ટોક (૩૧-૩-૧૫)	૨૬૦૦૦૦
૧૦%ના કિર્બેચર	૧૦૦૦૦૦	હાથ પર રોકડ	૩૪૦૦૦૦
લોન	૧૪૦૦૦૦	હાથ પર રોકડ	૩૩૦૦૦
ફિક્સ્ડ કિપોઝીટ	૩૫૦૦૦	પાઘડી	૨૦૦૦૦૦
સામાન્ય અનામત	૧૬૦૦૦૦	રોકાણો	૨૧૭૦૦૦
શેર પ્રિમિયમ	૧૫૦૦૦	પ્લાન્ટ અને ચંત્રો	૪૫૦૦૦૦
નફા-નુકશાન ખાતુ(૧-૪-૧૪)	૩૧૦૦૦	દેવાદારો	૧૧૮૦૦૦
કાચો નફો	૩૮૦૦૦૦	લેણી હૂંડી	૩૦૦૦૦
પ્રોવિડન્ડ ફંડ	૪૦૦૦૦	છૂટા ઓજારો	૧૪૦૦૦
ચૂકવવા બાકી ખર્ચા	૧૧૦૦૦	પગાર	૮૦૦૦૦
નહીં મંગાવેલ કિવિડન્ડ	૧૦૦૦૦	પ્રોવિડન્ડ ફંડમાં ફાળો	૧૮૦૦૦
લોન પર ચૂકવવાનું થયેલ વ્યાજ	૩૦૦૦	કિર્બેચર પર વ્યાજ	૫૦૦૦
લેણદારો	૧૦૦૦૦૦	વીમો	૮૦૦૦
રોકાણો પર વ્યાજ	૧૦૦૦૦	ભાડુ અને કર	૪૦૦૦૦
		ફર્નિચર	૫૫૦૦૦
		ઓફિટ ફી	૧૦૦૦૦
		સમારકામ	૧૩૦૦૦
		મોટર	૪૮૦૦૦
		કિર્બેચર પર વટાવ	૧૦૦૦૦
		કસ્ટમ કિપોઝીટ	૨૩૦૦૦
		તાર અને ટપાલ	૪૦૦૦
		કિરેક્ટર ફી	૨૦૦૦૦
		બાંહેધરી કમિશન	૧૫૦૦૦
		જાવક માલ ગાડા ભાડુ	૨૪૦૦૦
	૨૦૩૫૦૦૦		૨૦૩૫૦૦૦

વધારાની માહિતી:

- (૧) પ્લાન્ટ અને ચંત્ર પર ૧૦%, અને ફર્નિચર અને મોટર પર ૫% લેખે ઘસારો ગણો.
- (૨) દેવાદારો પર ૫% ઘાલખાધ અનામત રાખો.
- (૩) રૂ. ૩૭૫૦૦ આવકવેરાની જોગવાઈ કરો.
- (૪) રોકાણો પર ચૂકવવા બાકી વ્યાજ રૂ. ૭૫૦૦ છે.
- (૫) બાંહેધરી કમીશન ૧/૫ માંડી વાળો.
- (૬) રૂ. ૩૫૦૦૦ સામાન્ય અનામત ખાતે લઈ જાવો.
- (૭) ડિરેક્ટરોએ ઈક્વિટી શેર પર ૫% ડિવિડન્ડની ભલામણ કરી છે.

ઉપરોક્ત માહિતી પરથી આડા પાકા સરવૈયાના સ્વરૂપમાં કંપની ધારા-૧૯૫૬ પ્રમાણે વાર્ષિક હિસાબો તૈયાર કરો.

પ્ર.૪

- | | |
|--|------|
| (અ) ટૂંકનોંધ લખો : AS-2 (માલામાન ધારાધોરણ) | (૦૭) |
| (બ) ટૂંકનોંધ લખો : AS-6 (ઘસારાખાતુ ધારાધોરણ) | (૦૮) |

અથવા

પ્ર.૪

- | | |
|--|------|
| (અ) હિસાબી ધોરણનો અર્થ સમજાવો. તેના લાભો વર્ણવો. | (૦૭) |
| (બ) IFRS શું છે ? વર્તમાન IFRS ની યાદી આપો. | (૦૮) |
